

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination**March/April-2025 (NEW COURSE)****Auditing and Corp. Governance - 1(Dse-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન. ૧	(અ) ઓડિટ શું છે? ઓડિટનું કાર્યક્ષેત્ર સમજાવો.	(૧૦)
	(બ) ઇ. ડી. પી. એટલે શું? વિગતવાર સમજાવો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન. ૧	(અ) ઓડિટિંગના ગૌણ ઉદ્દેશો સમજાવો.	(૧૦)
	(બ) ચાલુ ઓડિટ એટલે શું? તેના ફાયદા અને ગેરફાયદા સમજાવો.	(૧૦)
પ્રશ્ન. ૨	આંતરિક અંકુશ શું છે? રોકડ વેચાણ માટે આંતરિક અંકુશ સમજાવો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન. ૨	તમે નીચેની બાબતોની ખાતરી કેવી રીતે કરશો?	
	(અ) પ્રાથમિક ખર્ચ (બ) બાયંધરી કમીશન (ક) રોકડ વેચાણ	
પ્રશ્ન. ૩	ચકાસણી એટલે શું? ચકાસણી અંગે ઓડીટરની ફરજો જણાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન. ૩	નીચેનાની ચકાસણી કેમ કરશો તે જણાવો.	
	(અ) આખર સ્ટોક (બ) સંભવિત દેવા (ક) પાઘડી	
પ્રશ્ન. ૪	રેટિંગ એજન્સીના ફાયદા સમજાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન. ૪	ટૂંક નોંધ:	
	(અ) પર્યાવરણ ગવર્નન્સ (બ) નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ	

ENGLISH VERSION

Que.1	(A) What is Audit? Explain scope of audit.	(10)
	(B) What is EDP? Explain in detail.	(10)
	OR	
Que.1	(A) Explain the secondary objectives of Auditing.	(10)
	(B) What is Current audit? Explain its advantages and disadvantages.	(10)
Que.2	What is Internal Control? Explain Internal Control for Cash Sales.	(20)
	OR	
Que.2	How will you vouch the following?	
	(A) Preliminary Expenses (B) Underwriting Commission (C) Cash sales	
Que.3	What is Verification? Explain the duties of Auditor regarding verification.	(15)
	OR	
Que.3	How will you verify the following:	
	(A) Closing Stock (B) Contingent Liabilities (C) Goodwill.	
Que.4	Explain the advantages of Rating Agency.	(15)
	OR	
Que.4	Write Short Note:	
	(A) Environmental Governance (B) Ethics and Corporate Governance	
